

M.Com Semester - 3 (CBCS) Examination
Oct/Nov. -2019 [NEW COURSE]
Advanced Cost & Financial Accounting (Elective)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન-1 ભાવિન કંપની લી. ની માર્ચ 2019 ની માહિતી નીચે આપેલ છે.

(20)

વિગત	રકમ રૂ.
ઉત્પાદન(એકમો)	4,000/-
વેચાણ (એકમો)	3,600 (એકમદીઠ રૂ.50 ની કિમતે)
પ્રત્યક્ષ માલસામાન	50,000/-
પ્રત્યક્ષ મજૂરી	30,000/-
પ્રત્યક્ષ ખર્ચ	4,000/-
ઉત્પાદન પરોક્ષ ખર્ચ : ચલિત	10,000/-
: સ્થિર	4,000/-
વહીવટી પરોક્ષ ખર્ચ : ચલિત	2,000/-
: સ્થિર	5000/-
વેચાણ પરોક્ષ ખર્ચ : ચલિત	10,000/-
: સ્થિર	16,000/-

ઉપરોક્ત માહિતી ના આધારે ચોખ્ખી આવકનું પત્રક તૈયાર કરો

- (1) સમાવેશી પડતર પદ્ધતિ
- (2) સીમાંત પડતર પદ્ધતિ

અથવા

પ્રશ્ન-1 નીચેની માહિતી સોનલ મેન્યુફેક્ચરીંગ કંપની લી.ની ઉત્પાદનને લગતી માહિતી આપેલ છે.

(20)

વિગત	2017	2018
વેચાણ (રૂ.)	8,00,000/-	9,60,000/-
નફો (રૂ.)	80,000/-	1,12,000/-

ગણતરી કરો :-

- (1) નફા-જથ્થાનો ગુણોત્તર
- (2) સ્થિર ખર્ચા
- (3) જ્યારે વેચાણ રૂ. 7,20,000/- હોય ત્યારે નફો
- (4) જ્યારે નુકસાન રૂ. 16,000/- હોય ત્યારે વેચાણ
- (5) રૂ. 1,60,000/- નફો કમાવવા માટે જરૂરી વેચાણ
- (6) સમતુલ બિંદુ રૂપિયામાં
- (7) રૂ. 6,00,000/-ના વેચાણે સલામતીગાળો

પ્રશ્ન-2 ગ્રીષ્મા કંપની લિમીટેડ સંકલિત હિસાબી પદ્ધતિ દ્વારા તેના હિસાબો રાખે છે.નિચેના વ્યવહારોમાંથી આમનોંધ લખો (20)

ક્રમ નં.	વિગત	રકમ રૂ.
1	માલસામાનની ઉધાર ખરીદી	20,00,000/-
2	માલસામાનની ખરીદી નો ખર્ચ	50,000/-
3	ઉત્પાદન વિભાગ ને આપેલ પરોક્ષ માલસામાન	10,00,000/-
4	માલસામાન નો સામાન્ય બગાડ	1,000/-
5	સ્ટોર્સ માંથી વેપારી ને માલસામાન પરત	10,000/-
6	એક ઉત્પાદન પરથી બીજા ઉત્પાદન પર માલસામાન ની ફેરબદલી	50,000/-
7	પરોક્ષ મજૂરી	18,000/-
8	પ્રત્યક્ષ મજૂરી ઉત્પાદન ખાતે લઈ જવામાં આવે	20,000/-
9	સામાન્ય નિષ્ક્રિય સમય ની મજૂરી	5000/-
10	પ્રત્યક્ષ ખર્ચ ચૂકવ્યો	15,000/-
11	કારખાના ખર્ચ ચૂકવ્યો	1,20,000/-
12	કારખાના ખર્ચ ફાળવ્યો	20,000/-
13	વેચાણ અને વિતરણ ખર્ચ ચૂકવ્યો	25,000/-
14	તૈયાર માલ	30,000/-
15	રોકડ વેચાણ	60,000/-
16	કાચો નફો	1,50,000/-
17	મશીનરી પર નો ઘસારો	8,000/-
18	લેણદાર ને ચુકવ્યા	40,000/-
19	ઘાલખાધ	4,000/-
20	દેવાદારો પાસેથી મળ્યા	2,00,000/-

અથવા

પ્રશ્ન-2 નિચેની માહિતી પરથી મનોજ કંપની લિમીટેડ ના વ્યવહારો આપેલા છે સંકલિત હિસાબી પદ્ધતિ દ્વારા તેના હિસાબો રાખે છે.. (20)

બાકી : 01-04-2018

શેરમૂડી : 10,00,000/-

લેણદારો : 10,00,000/-

દેવાદારો : 4,00,000/-

બેંક સિલક : 1,50,000/-

પ્લાન્ટ : 11,50,000/-

આખર સ્ટોક 3,00,000/-

વર્ષ દરમિયાનના વ્યવહારો નીચે પ્રમાણે હતા

વિગત	રકમ રૂ.
પ્રત્યક્ષ મજૂરી ચૂકવી	13,00,000/-
માલસામાન ની ખરીદી	20,00,000/-
ઉત્પાદન માટે માલ આપ્યો	21,00,000/-
પ્રત્યક્ષ મજૂરી ઉત્પાદન ખાતે ફાળવી	12,00,000/-
કારખાના ખર્ચ ચૂકવ્યો	6,00,000/-
કારખાના ખર્ચ ફાળવ્યો	5,50,000/-

વેચાણ-વિતરણ ખર્ચા	2,00,000/-
તૈયાર માલનું ઉત્પાદન પડતર કિંમતે	36,00,000/-
વેચાણ	44,00,000/-
માલસામાન (31-3-2019)	1,90,000/-
તૈયાર માલનું આખરસ્ટોક	1,90,000/-
લેણદારો ચુકવ્યા	22,00,000/-
ગ્રાહકો પાસેથી મળ્યા	42,00,000/-

જરૂરી ખાતા તૈયાર કરો અને કાયું સરવૈયુ 31-03-2019 બનાવો.

પ્રશ્ન-3 વીરા કંપની લિમીટેડ બિનસંકલિત હિસાબી પદ્ધતિ દ્વારા તેના હિસાબો રાખે છે. નિચેના વ્યવહારોમાંથી (15) આમનોંધ લખો.

ક્રમ નં.	વિગત	રકમ રૂ.
1	માલસામાનની રોકડ ખરીદી	10,00,000/-
2	ઉત્પાદન માટે માલસામાનની ખરીદી	5,00,000/-
3	માલસામાન નો અસામાન્ય બગાડ	2,500/-
4	જોબ પરથી માલસામાન સ્ટોર્સ માં પરત	10,000/-
5	માલસામાનનું વેચાણ	50,000/-
6	કુલ મજૂરી ચુકવવામાં આવે	32,000/-
7	મરામત માટે માલસામાન મોકલ્યો	5,000/-
8	અસામાન્ય નિષ્ક્રિય સમય ની મજૂરી	3,000/-
9	ગ્રાહકો પાસેથી મળ્યા	45,000/-
10	વહીવટી ખર્ચ ચૂકવ્યો	60,000/-
11	વહીવટી ખર્ચ ફાળવ્યો	6,000/-
12	વિતરણ ખર્ચ ફાળવ્યો	4,000/-
13	વેચાણ પડતર	1,20,000/-
14	ઉધાર વેચાણ	1,00,000/-
15	ચોખ્ખો નફો	80,000/-

અથવા

પ્રશ્ન-3 ખુશાલી કંપની લિમીટેડ બિનસંકલિત હિસાબી પદ્ધતિ દ્વારા તેના હિસાબો રાખે છે. તા. 01-04-2018 ની (15) કેટલીક બાકીઓ નીચે મુજબ

વિગત	ઉધાર રૂ.	જમા રૂ.
ચાલુ કામ ખાતાવહી નિયંત્રણ ખાતું	1,04,000/-	
તૈયાર માલ ખાતાવહી નિયંત્રણ ખાતું	46,000/-	
કારખાના શિરોપરી ખર્ચ ખાતું	1,000/-	
વહીવટી શિરોપરી ખર્ચ ખાતું	600/-	
માલસામાન ખાતાવહી નિયંત્રણ ખાતું	23,000/-	
સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતું		1,74,600
	1,74,600	1,74,600

વર્ષ 2018-19 ના દરમ્યાન ના વ્યવહારો:

વિગત	રકમ રૂ.
પ્રત્યક્ષ મજૂરી	1,50,000/-
પરોક્ષ મજૂરી	10,000/-
કારખાના પરોક્ષ ખર્ચ	29,000/-
વહીવટી પરોક્ષ ખર્ચ	23,400/-
ઉત્પાદન ખાતે વસુલ કરેલ કારખાના ખર્ચ	44,000/-
ઉત્પાદન ખાતે વસુલ કરેલ વહીવટી ખર્ચ	24,000/-
ઉત્પાદન અંગે આપેલ માલસામાન	98,000/-
વર્ષ દરમ્યાન થયેલ તૈયાર માલ ની પડતર	3,60,000/-
વેચેલ માલ પડતર કિમતે	3,80,000/-
માલસામાન ની ખરીદી	1,00,000/-
કારખાનામાં મરામત માટે મોકલેલ માલસામાન	4,000/-
ઉત્પાદન માટે પુરા પાડેલ માલસામાનનું આવકમાલ ગાડાભાડું	1,600/-
વેચાણ	4,20,000/-

કંપનીના પડતરના ચોપડામાંથી મેળવેલ ઉપરોક્ત માહિતી પરથી પડતર ખાતાવહીમાં જરૂરી ખાતા અને તા.

31-03-2019 ના રોજ કાયું સરવૈયુ બનાવો.

પ્રશ્ન-4 (a) બેંચ માર્કિંગનો અર્થ શું છે અને બેંચ માર્કિંગના પ્રકારો સમજાવો. (08)

પ્રશ્ન-4 (b) બેલેન્સ સ્કોર કાર્ડના ફાયદા અને મર્યાદાઓ વર્ણવો. (07)

અથવા

પ્રશ્ન-4 ટૂંક નોંધ લખો.

(a) આંતર પેઢી તુલના ના ફાયદા અને મર્યાદા. (08)

(b) સમાન પડતર પદ્ધતિના હેતુઓ. (07)

ENGLISH VERSION

Que-1. Following details are related to Bhavin Company Ltd. for March-2019.

(20)

Particulars	Amount Rs
Production (Units)	4,000/-
Sales (Units)	3,600 (Per unit selling price Rs. 50)
Direct Material.	50,000/-
Direct Wages.	30,000/-
Direct expenses.	4,000/-
Production overhead : Variable	10,000/-
: Fixed	4,000/-
Administrative overhead : Variable	2,000/-
: Fixed	5000/-
Selling overhead : variable	10,000/-
: Fixed	16,000/-

From the above particulars prepare Net Income statement.

- (1) Absorption costing.
- (2) Marginal costing.

OR

Que-1. The following information is related to production of Sonal manufacturing company ltd (20)

Particulars	2017	2018
Sale(Rs.)	8,00,000/-	9,60,000/-
Profit (Rs.)	80,000/-	1,12,000/-

Calculate:-

- (1) P/V Ratio.
- (2) Fixed expenses.
- (3) Profit where sale is Rs. 7,20,000/-
- (4) Loss where sale is Rs. 16,000/-
- (5) Sales to earn profit of Rs. 1,60,000/-
- (6) Break-even point (In Rupees)
- (7) When actual sales is Rs. 6,00,000/-, margin of safety.

Que-2. Grishma Co. Ltd. keeps their accounts by Integrated accounting system. Write journal entries from the following transactions (20)

Sr.No	Particulars	Rs
1	Credit purchase of material.	20,00,000/-
2	Expenses For purchase of material.	50,000/-
3	Indirect material given to production	10,00,000/-
4	General wastage of material.	1,000/-
5	Material Returned to supplier.	10,000/-
6	Material transfer from one production to another Production	50,000/-
7	Indirect Labour	18,000/-
8	Direct Labour transfer to production	20,000/-
9	Wages for normal Ideal time.	5000/-
10	Direct expenses paid	15,000/-
11	Production overhead paid	1,20,000/-
12	Factory overhead absorbed	20,000/-
13	Selling and Distribution overhead paid.	25,000/-
14	Finished goods	30,000/-
15	Cash sales	60,000/-

16	Gross Profit	1,50,000/-
17	Depreciation on machinery	8,000/-
18	Cash paid to Creditors	40,000/-
19	Bad Debts	4,000/-
20	Cash received from Debtors	2,00,000/-

OR

Que-2. The following information and transactions have been taken from Manoj co.ltd Cost accounts. The company maintains integral accounting system. (20)

Balances as on 01-04-2018

Share capital 10,00,000/-

Creditors 10,00,000/-

Debtors 4,00,000/-

Bank Balance 1,50,000/-

Plants 11,50,000/-

Stock 3,00,000/-

Transactions during the year were as under:

Particulars	Amount Rs.
Direct labour paid	13,00,000/-
Materials purchased	20,00,000/-
Materials issued for production	21,00,000/-
Direct labour allocation	12,00,000/-
Factory expenses paid	6,00,000/-
Allocation of Factory overhead	5,50,000/-
Selling expenses paid	2,00,000/-
Finished Production at Cost	36,00,000/-
Sale	44,00,000/-
Material A/c (31-3-2018)	1,90,000/-
Closing Stock of Finished goods	1,90,000/-
Payment to Creditors	22,00,000/-
Receipt from Customers	42,00,000/-

Prepare necessary control account and trail balance sheet as on 31-03-2019

Que-3. Veera Company Ltd. keeps their accounts by Non-Integral Accounting system. Write Journal entries from the following transactions. (15)

Sr. No	Particulars	Rs.
1	Cash purchase of material	10,00,000/-
2	Purchase of material for production	5,00,000/-
3	Abnormal Loss of material	2,500/-
4	Material Returned from Job	10,000/-
5	Material is sold	50,000/-
6	Total Labour Paid.	32,000/-
7	Material issued for repairing	5,000/-
8	Wages of Ideal in Abnormal	3,000/-
9	Cash received from Customer	45,000/-
10	Administration overhead paid	60,000/-
11	Office overhead Allocated	6,000/-
12	Distribution overhead absorbed	4,000/-
13	Cost of goods sold	1,20,000/-
14	Credit sales	1,00,000/-
15	Net profit	80,000/-

OR

Que-3. Khusali Company maintains Non-integral accounting system. The following information (15) on 01-04-2018 Some balances were:

Particulars	Debit Rs	Credit Rs
Work in progress Ledger control A/c.	1,04,000/-	
Finished goods Ledger Control A/c.	46,000/-	
Factory overhead A/c.	1,000/-	
Administrative overhead A/c.	600/-	
Stores Ledger control A/c.	23,000/-	
General Ledger Control A/c.		1,74,600
	1,74,600	1,74,600

Transactions during the year 2018-19 were as under.

Particulars	Debit Rs
Direct wages	1,50,000/-
Indirect wages	10,000/-
Factory overheads	29,000/-
Administration overheads	23,400/-
Factory expenses recovered in production A/c	44,000/-
Administration expenses recovered in production A/c	24,000/-
Material issued for production	98,000/-
Cost of Finished goods during the year	3,60,000/-
Cost of goods sold	3,80,000/-
purchase of material	1,00,000/-
Material issued for factory for repairing	4,000/-
Cartage inward of the materials issued for production	1,600/-
sales	4,20,000/-

Prepare necessary accounts in the Cost Ledger from the above information received from the cost ledger of the company and also prepare Trial Balance as on 31-03-2019

- Que-4.** (a) What do mean of Bench Marking and explain the types of Bench Marking. (08)
 (b) Describe advantages and Limitations of Balanced Score Card (07)

OR

Que-4. Write on Short note

- (a) Benefits and Limitations of Inter-Firm comparison (08)
 (b) Objectives of uniform costing (07)
